

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાત્રી કર્ફ્યુનો સમય ઘટાડવા તથા લગ્ન પ્રસંગો કે અન્ય ક્યોમાં માણસોની મર્યાદા વધારવા બાબત રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી...

કોરોના વૈશ્વિક મહામારીની ત્રીજી લહેર ભારત દેશમાં પુરે ઝડપથી વધી રહેલ ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ મહામારીને કાબુમાં લેવા માટે કોવિડ નિયંત્રણો થોડા કડક બનાવેલ જે થકી રાજ્યની તમામ પ્રજા આજે કોરોના મહામારીમાં સામે સલામતી અનુભવે છે. તેમજ આવા ઝડપી નિયંત્રણો અને સુંદર કામગીરી થકી અને પ્રજાની જાગૃતિથી અન્યો રાજ્યો કરતા ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખુબ જ કન્ટ્રોલમાં છે. જે આવકારદાયક છે.

હાલ રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના ૧૦:૦૦ થી સવારના ૬:૦૦ સુધીનો કરાયેલ છે. જેના કારણે વેપાર-ઉદ્યોગોકારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને આર્થિક નુકશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાથો સાથ ૩ શીફ્ટમાં ચાલતા ઉદ્યોગોમાં કર્મચારીઓ કે મજૂરોને અવર-જવર કરવામાં પણ હાલાકી પડી રહી છે. તેથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના ૧૧:૦૦ થી સવારના ૬:૦૦ સુધી કરવો ખાસ જરૂરી છે. જેથી વેપાર-ધંધાઓ વેગ પકડે અને આર્થિક મંદીમાંથી બહાર આવે.

રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગો કે અન્ય ધાર્મિક ક્યો વિગેરેમાં ૧૫૦ માણસોની મર્યાદા નક્કિ કરેલ છે. હાલ કોરોનાના દૈનિક કેસોમાં ખુબ જ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં આવી ગયેલ છે. તેથી લગ્નપ્રસંગો કે અન્ય ક્યોમાં ૪૦૦ માણસોની છુટ આપવી.

ફોરવ્હીલમાં સીંગલ વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરેલ છે. પરંતુ તેમાં કોઈપણ જાતનું કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા રહેતી નથી. તેથી ફોરવ્હીલમાં સીંગલ વ્યક્તિને માસ્ક પહેરવાનો નિયમ પણ સત્વરે રદ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમગ્ર વેપાર-ઉદ્યોગ આલમ તથા લોક લાગણીને ધ્યાનમાં રાખી આ અંગે સત્વરે ઘટતું કરવા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.